

**पूर्वन:** - उलगालेक (जनीति) के दो आवं तथा अमान हैं,  
उलगालेक (जनीति) के प्रभाव (जन सेवा के)  
दोनों रूपों के।

**उन्नी-** उलगालेक (जनीति) विभिन्न जाति-वर्गीयों  
(जनीति) का विभाजन; जो जनीति के अपहार के  
उलगालेक दो दो अधिकार तथा / प्रक्रिया है।

"Comparative politics is comparative analysis of various forms of government and diverse political institutions" — Edward Freeman.

जैसा शब्दानुसार — "उलगालेक"  
(जनीति) में सामाजिक व्यवस्था में वर्ग वर्षा, ज  
प्रशंसनी वाले व्यक्तियों जो (जनीति) में प्रगति की  
वाहकी एवं व्यावायिक व्यवस्था के प्रभावों के  
रूप में उन विषयों के उलगालेक  
(जनीति) में इन विषयों के समाजी एवं सामाजिक  
उलगालेक के लिए जो आवश्यक व्यवस्था होती  
होती है विषय विषयों के जहान विली और वे अव  
हलमें हैं।

कुलग उलगालेक (जनीति) के प्रभावों के  
दृष्टि में दो रूप है उलगालेक (विषय) हैं—

- (1) उलगालेक (जनीति) का उलगालेक उलगालेक (विषय) है।
- (2) उलगालेक (जनीति) का उलगालेक उलगालेक (विषय) है।
- (3) उलगालेक (जनीति) का उलगालेक उलगालेक (विषय) है।

विषय (विषय) के अधिकारों

इन दो दो उलगालेक (जनीति) के अधिकारों (विषय) के  
दोनों में विभिन्न विभिन्न विषयों के अधिकारों विभिन्न  
संघों तथा उनको प्रभावित करने वाले (जनीति)  
अपहारों के उलगालेक विषयों (विषय) हैं।  
इस मत के मानने वाले यह लक्ष्य है कि प्रत्येक  
विषय में अंतर्कालीन विषयों विषयों का विवरण हो।

20 वर्षों में भारत के सभी के अनुसारी की लगा था।  
 (१) उलगामक (अनीति) के नियम हैं।

आपोयों द्वारा हम यह कि सरीकरण  
 जिस गति द्वारा आपोयों की यह दृष्टि भवति  
 कि आपोयों के बीच विभिन्न वाली समाज की  
 है ऐसा याति हम इन समाजों की असमिका में जाति  
 हो नहीं, ऐसी असमिका ही दृष्टि पड़ती है।

of economic means - Equality of Rules :-

Equality of power कि अपि एवं विभिन्न आदायक  
 उत्तर ने यह कि यह तुम्हें समानाधीन के  
 बाबजुद (एकीय वय) को लक्ष्य के अनुसार में  
 असमानता द्वारा विकास हो से में समानाधीन के  
 अन्तर में उलगामक असमिका असमिका की लगत है।

(२) उलगामक (अनीति) के अन्तर्गत उलगामक है:-

इस अनीति के अन्तर्गत उलगामक (अनीति) की  
 वास्तविकी उलगामक (अनीति) की  
 प्रकृति निम्न विवृक्षों के अन्तर्गत है। —

(३) इस (एकीय वय) के लिये उलगामक है:-

प्रत्येक एकीय के अन्तर्गत (अनीति)  
 व्यष्टि की एक अन्तर्गत विशालिके व्यवस्थाओं की है।  
 अन्तर्गत (अनीति) व्यष्टि की प्रत्येक व्यवस्थाओं की अन्तर्गत  
 की लगत अन्तर्गत उलगामक (अनीति) की अन्तर्गत  
 की लगत अन्तर्गत अन्तर्गत अन्तर्गत अन्तर्गत अन्तर्गत  
 अन्तर्गत अन्तर्गत अन्तर्गत अन्तर्गत अन्तर्गत अन्तर्गत अन्तर्गत

(४) अमेरिका 1929 में व्यापत्ति (एकीय में अन्तर्गत) की व्यवस्था

उलगामक : — हम यह कि लहर अमेरिका 1929 की  
 (अनीति) व्यष्टि व्यवस्थाओं के अन्तर्गत (एकीय अन्तर्गत) का  
 (एकीय अन्तर्गत) के 1918-19 असमिका अन्तर्गत है।

वेद आज इसकी प्रकृति अन्तर्गत अन्तर्गत है।  
 यह एक उलगामक (अनीति) व्यष्टि 1929 की दृष्टि के अन्तर्गत  
 (एकीय में अन्तर्गत) की व्यवस्था अन्तर्गत अन्तर्गत अन्तर्गत है।

(3)

કું ગોર્ડ-પીર કુલગામનું જીવનાનું હૈ (91-248)  
 અત્યારી નિર્મિત પ્રાણી આજાનું એવું (જાળી) નિર્મિત વ્યવસ્થાનું હૈ એવું એવું  
 એવું એ પ્રાણી નિર્મિત તથી બાળી હોય એવી જીવનાનું  
 કું ગોર્ડ કુલગામનું હૈ।

જીવન જીવનાનું (જાળી) એવી હૈ એંચ-

પારદર્શિકા હોય હું હાજરીની દેખીં કું પંચાંગની કુલગામનું  
 નિર્મિત હોય કુલગામનું (જાળી) હૈ (91-248); (જાળી) નિર્મિત  
 પંચાંગની કું ગોર્ડ જીવનાની નિર્મિત સંયોગની રૂંગ પ્રાણીની  
 જીવનાનું હૈ કુલગામનું (જાળી) હૈ - નિર્મિત  
 (જાળી) નિર્મિત પારદર્શિકા નિર્મિત હોય કું ગોર્ડ  
 હોય (જાળી) નિર્મિત પારદર્શિકા - કુલગામની (જાળી) નિર્મિત પ્રાણીની  
 જીવનાનું (જાળી) નિર્મિત પ્રાણીની - કુલગામની જીવનાનું  
 કું ગોર્ડ હૈ

કુલગામનું (જાળી) નિર્મિત હૈ કું ગોર્ડ હૈ  
 એંચ (જાળી) નિર્મિત હોય કુલગામનું હૈ એંચ નિર્મિત હોય  
 એવી સાધારણ અંગ જીવની હૈ કુલગામનું હૈ એવી સાધારણ  
 જીવનાનું હૈ એવી હોય એવી જીવનાનું (જાળી) નિર્મિત  
 હૈ (જાળી) - કુલગામનું (જાળી) નિર્મિત હોય કુલગામનું (જાળી)  
 જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી) નિર્મિત  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી) નિર્મિત  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)  
 હૈ એવી જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જીવનાનું (જાળી)

જીવની જરૂર સંયોગના દુઃખિકૃતી :

જીવની જરૂર સંયોગના દુઃખિકૃતી કું ગોર્ડ  
 એ હી હી હી. કુલગામનું (જાળી) નિર્મિત હોય એવી સાધારણ  
 જીવનાનું (જાળી) નિર્મિત હોય એવી જરૂર સંયોગના  
 જરૂર સંયોગના દુઃખિકૃતી (જાળી) નિર્મિત વ્યવસ્થાનું (જાળી)  
 જરૂર સંયોગના દુઃખિકૃતી (જાળી) નિર્મિત વ્યવસ્થાનું (જાળી)

(4) માનવે વાળોં કુઠાન હૈ 18 પંચમાંથી દ્વિતીયાં  
કુઠાની ઘર બિલાંગ છલા કુઠી જીવાંગ  
દ્વિતીયાં કુઠી જીવાંગ વેળ હૈ 18માં  
મેં ઉન્ના પણીએ દુષ્પાદાં કુઠી જીવાંગ, પંચમાં  
નાં હુંઠી જીવાંગ વેળ કુઠી જીવાંગ  
—૧૧૧૩૧

બન્ના કુઠી જીવાંગ દ્વિતીયાં હુંઠી જીવાંગ  
બોલોયોં કુઠી જીવાંગ વેળ કુઠી જીવાંગ  
દ્વિતીયાં જીવાંગ વેળ કુઠી જીવાંગ

(૫) અભિજાત કુઠીયોં : —

દ્વિતીયોં કુઠીયોં માનવે વાળો  
જીવાંગી કુઠી જીવાંગ દુષ્પાદાંગ (જની)ની સેંદ્રિય  
સુધુની અધ્યાત્મા હું જીવાંગ કુઠી જીવાંગ  
દુષ્પાદાંગ વેળ કુઠી જીવાંગ દુષ્પાદાંગ પ્રશ્ન  
હૈ 18 (જની)ની અધ્યાત્મા દુષ્પાદાંગ અભિજાત  
જીવાંગ હૈ તથા (જની)ની દુષ્પાદાંગ જીવાંગ  
દુષ્પાદાંગ દુષ્પાદાંગ જીવાંગ (જની)ની જીવાંગ  
પરિણામ સેંદ્રિય ની દુષ્પાદાંગ અધ્યાત્મા દુષ્પાદાંગ  
દુષ્પાદાંગ જીવાંગ હૈ 18  
દુષ્પાદાંગ (જની)ની પદ્ધતિઓ સર્વાર્થીના હૈનો  
(જની)ની દુષ્પાદાંગ કુઠી જીવાંગ અધ્યાત્મા દુષ્પાદાંગ  
ની દુષ્પાદાંગ જીવાંગ (જની)ની અધ્યાત્મા દુષ્પાદાંગ  
દુષ્પાદાંગ (જની)ની અધ્યાત્મા દુષ્પાદાંગ

દુષ્પાદાંગ (જની)ની કુઠી જીવાંગ દુષ્પાદાંગ  
દુષ્પાદાંગ જીવાંગ દુષ્પાદાંગ જીવાંગ  
દુષ્પાદાંગ જીવાંગ દુષ્પાદાંગ જીવાંગ  
દુષ્પાદાંગ જીવાંગ દુષ્પાદાંગ જીવાંગ